

ત્વરિત જાહેરાત માટે

ઓન્ટેરિયોમાં જુવાનિયાઓ માટે સૌથી અનુકૂળ સમુદાયોમાંના એક તરીકે બ્રેમ્પટનને ઓળખ મળી

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (મે 7, 2020) – સીટી ઓફ બ્રેમ્પટનને પાર્ક્સ એન્ડ રિક્રિએશન ઓન્ટેરિયો દ્વારા સહાયક કાર્યક્રમ, પ્લે વર્ક્સ તરફથી ફરી એકવાર પ્લેટિનમ યુથ ફેન્ડલી કમ્યુનિટી પદ મળ્યું છે.

જુવાનિયાઓને વૃદ્ધિ અને વિકાસની તકો આપવા સીટીની પોતાની ઉત્કૃષ્ટ કટિબદ્ધતા માટેની ઓળખ ત્રીજી વખત મળી છે, અને બ્રેમ્પટન આ વર્ષે ટોચનું પ્લેટિનમ પદ મેળવનાર ત્રણ સમુદાયોમાંનો એક સમુદાય બન્યો છે.

યુથ ફેન્ડલી કમ્યુનિટી પદ આખા ઓન્ટેરિયોમાં 13 થી 19 વર્ષની ઉંમરના જુવાનિયાઓની અજોડ જરૂરિયાતોને ઓળખતા સમુદાયોને દર ત્રણ વર્ષે આપવામાં આવે છે, અને ખાતરી કરે છે કે તેઓ કળા, મનોરંજન અને નાગરિક સહભાગિતામાં શ્રેણીબદ્ધ આગેવાની અને પ્રવૃત્તિ તકો સુધી સતત પહોંચી શકે. સમુદાયોએ દસ જુવાન-અનુકૂળ માપદંડોમાંથી ઓછામાં ઓછાં સાત સંતોષવાના રહે છે. તમામ દસ માપદંડ સંતોષનારને પ્લેટિનમ સ્ટેટસ મળે છે. હાલમાં, ઓન્ટેરિયોમાં 47 જેટલા સમુદાયોને જુવાનિયાઓ માટે અનુકૂળ તરીકે ઓળખવામાં આવ્યા છે.

બ્રેમ્પટન 13 થી 19 વર્ષની ઉંમરના 58,800 જુવાનિયાઓનું ઘર છે, જેમાંના 43,111 લાગુ પડતા સીટીની આગેવાનીના કાર્યક્રમો જેમ કે, મે મહિનામાં નેશનલ યુથ વીકમાં સહભાગી થાય છે.

બ્રેમ્પટનની શ્રેણીબદ્ધ સંસ્થાઓ અને સમુદાયમાં સેવા ભાગીદારોએ પણ આ વર્ષનું પદ મેળવવામાં ફાળો આપ્યો છે. પૂરી યાદી જોવા અહીં ક્લિક કરો.

પ્લે વર્ક્સ જુવાનિયાઓના ભવિષ્ય વિશે ચિંતિત સંસ્થાઓનું એક સમૂહ છે અને સમગ્ર ઓન્ટેરિયોના સમુદાયોમાં જુવાનિયાઓની સામેલગીરી વધારવા સાથે મળીને કાર્યરત છે. પ્લે વર્ક્સ ભાગીદારોમાં સામેલ છે: 4-H ઓન્ટેરિયો; આર્ટ્સ નેટવર્ક ફોર ચિલ્ડ્રન એન્ડ યુથ; બોયસ્ એન્ડ ગર્લ્સ ક્લબ્સ ઓફ કેનેડા – સેન્ટ્રલ રીજીયન; ઓફિયા; પાર્ક્સ એન્ડ રિક્રિએશન ઓન્ટેરિયો; YMCA (વાય.એમ.સી.એ.) ઓન્ટેરિયો.

અવતરણો (ક્વોટ્સ):

“નેશનલ યુથ વીક આવી રહ્યું છે, અને તકો આપતા શહેર તરીકે, અમે અમારા જુવાનિયાઓને શીખવા, વિકસવા અને રમવા દેવા સીમા રહિત જગ્યાઓ પૂરી પાડવા કટિબદ્ધ છીએ. અમે ઓન્ટેરિયોમાં જુવાનિયાઓ માટે અનુકૂળ સમુદાય તરીકે આ પદ ફરી એકવાર હાંસલ કરવામાં ગૌરવ અનુભવીએ છીએ, અને હું તે મેળવવામાં મદદરૂપ થવામાં મહત્વની ભૂમિકા ભજવનાર આપણાં ઉત્કૃષ્ટ સામુદાયિક ભાગીદારોનો આભાર માનવા ઈચ્છું છું. આ અજમાયશના સમય દરમિયાન, હું બ્રેમ્પટનમાં જુવાનિયાઓને સીટીની સોશિયલ ચેનલોને અનુસરવા અને પ્રવૃત્તમય રહેવા શ્રેણીબદ્ધ વર્ચ્યુઅલ (વાસ્તવિક) પ્રવૃત્તિઓ માટે વેબસાઈટ brampton.ca જોવા પ્રોત્સાહિત કરું છું.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“તાજેતરમાં, સીટી ઓફ બ્રેમ્પટનને પોતાની પહેલી યુથ એંગેજમેન્ટ સ્ટ્રેટેજી રજૂ કરી, જે જુવાનિયાઓ માટે, જુવાનિયાઓ દ્વારા – ઓન્ટેરિયોમાં તેના પ્રકારની પહેલી વ્યૂહરચના છે. સીટી સ્ટાફ બ્રેમ્પટનમાં જુવાનિયાઓનું સશક્તિકરણ કરવા સમર્પિત છે અને અમે કાર્યક્રમો

અને પહેલ વિકસાવતી વખતે જુવાનિયાઓની નજરને ધ્યાનમાં લેવાનું ચાલુ રાખ્યું છે. અમે જુવાનિયાઓ સાથે પ્રવૃત્તમય થઈને અમારી અવિરત કામગીરી માટે ભાવિ વર્ષોમાં આ સન્માન મેળવવાનું ચાલુ રાખવા આશાવાદી છીએ.”

- ડેવિડ બાર્રિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રમ્પટન

“આ શહેરો અને નગરોએ જુવાનિયાઓની સામેલગીરી માટે સમગ્ર સમુદાયને આવરી લેતો અભિગમ દેખાડ્યો છે. તેઓએ જુવાનિયાઓ હોય ત્યાં તેઓને મળવા અને તેઓને અવાજ ઉઠાવવા અને નિર્ણય લેવામાં સક્રિય ભૂમિકા આપવા નોંધપાત્ર પ્રયત્નો કર્યા છે. જુવાનિયાઓને આગેવાની ભૂમિકાઓ ભજવવા અને તેઓને પોતાની રફૂલો, પાડોશ અને સમુદાયોના એકંદરે આરોગ્ય અને ગતિશીલતામાં ફાળો આપવા સશક્ત કરવામાં આવી રહ્યાં હોવાથી અમે સરસ પરિણામો મેળવી રહ્યાં છીએ.”

- કેથી ડેનયર (Cathy Denyer), સીઈઓ, પાર્ક એન્ડ રિક્લિએશન ઓન્ટેરિયો

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca